

be formally arrested and produced before a court.

The accused Habib Hingroja (30) and Nasir Khan Malek (22) are residents of Sidhada and Varahi villages of Santalpur taluka in Patan district respectively. The two have been booked under the provisions of the Wildlife Protection Act and Arms Act, maximum punishment for which is seven years' imprisonment.

They were detained by Range Forest Officer (RFO) of Patan Zilubha Vaghela and his team. Vaghela said, "On May 18, I was on a night patrolling in the reserve forest area near Santalpur when I spotted two persons moving around suspiciously on a motorbike. I chased them but they tried to speed away but lost balance and fell down, after which they abandoned the motorbike and ran away. When I reached near the motorbike, I found a chinkara and three rabbits killed with a .303 rifle."

"We took the motorbike in our possession and traced its owner on the basis of its registration number. We found that the vehicle belonged to one of Nasir's cousins. We also found out that Nasir and Habib were using the motorbike for the past few days. Eventually, we caught the two," Vaghela added. Vaghela said that because of the lockdown, many people tend to move into reserve forest areas to hunt animals for meat with a belief that nobody will spot them. "Last week also, we arrested three persons who hunted two rabbits. To prevent such incidents, we have increased patrolling in the area," he said.

CEPT Monsoon Semester to be held online

Ahmedabad: The CEPT University in Ahmedabad will commence all courses and studios of its Monsoon Semester 2020 online from July 27. In the previous semester, online teaching was only for half the semester.

"CEPT University is viewing this as an opportunity to explore the potential of online teaching and learning. Over the next few weeks, courses and studios will be prepared to better align them with the online learning format," said Provost Tridip Suhud.

Continuing for 18 working weeks, the semester will have nearly 50 studios at undergraduate and 35 studios at postgraduate levels, conducted by over 120 experts. **ENS**

5.	PRT Special Educator	Bachelors degree in Psychology with 50% marks & B.Ed	
6.	Receptionist	Experienced graduate with good communication skills and computer literate	Below 40 years as on 15 Jun 2020

Apply on plain paper with Bio-Data affixed with Photograph, self attested copies of qualifications, experience certificate indicating tenure as Lec/PGT/TGT/Vice Principal/Principal in Secy/Higher Secy/equivalent school/Collage, birth/10th pass certificate, e-Mail ID, mobile number and postal address. **Applicants to forward soft copy/scanned application and documents to e-mail ID: apsahmedabad@gmail.com and carry original documents on date of interview.**

Last Date : 15 Jun 2020
(Application submission)
TA/DA - Not Admissible

Interview Dates
Principal : 19 Jun 20
Teachers : 24 & 25 Jun 20

Forward hard & soft copy of application to : Director AWES, HQ Southern Command Pune (Maharashtra), PIN - 411 001. (Tele No 020-26363217)
e-mail ID : awescellsc@gmail.com



CIN: L65110GJ1993PLC020769

Registered Office: "Trishul" 3rd Floor, Opp. Samarsheshwar Temple, Law Garden, Ellisbridge, Ahmedabad-380 006. Gujarat
Tel No.: +9179-6630 6161, Fax No.: +9179-2640 9321
Email: shareholders@axisbank.com Website: www.axisbank.com

NOTICE TO THE SHAREHOLDERS OF THE BANK

SUB: TRANSFER OF UNCLAIMED DIVIDEND FOR THE FINANCIAL YEAR 2012-13 AND THE UNDERLYING EQUITY SHARES OF AXIS BANK LIMITED TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND AUTHORITY.

REF: SECTION 124 & 125 OF THE COMPANIES ACT, 2013 AND THE INVESTOR EDUCATION AND PROTECTION FUND AUTHORITY (ACCOUNTING, AUDIT, TRANSFER & REFUND) RULES, 2016, AS AMENDED.

Notice is hereby given to the shareholders of Axis Bank Limited ('the Bank') that in terms of Sections 124 & 125 of the Companies Act, 2013 and the Rule 6 (3) (a) of the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer & Refund) Rules, 2016, as amended (the Rules), the Bank is required to transfer the equity shares in respect of which dividend(s) has remained unclaimed or unpaid for a period of seven consecutive years or more to the DEMAT account of the IEPF Authority, within 30 days from the due date of transfer.

In terms of the IEPF Rules, the Bank has sent individual letters to the concerned shareholders at their registered addresses available with KFin Technologies Private Limited (KFin), the Registrar & Share Transfer Agent (RTA) of the Bank, whose dividend(s) have remained unpaid or unclaimed for last seven consecutive years or more, advising them to claim their unclaimed dividend(s) on or before 4th August 2020, failing which the Bank will proceed to transfer the unclaimed dividend for the financial year 2012-13 and the corresponding equity share(s) of the Bank, to IEPF Authority, on or after the due date of 24th August 2020, in accordance with the Rules.

Further, the Bank has uploaded the details of the concerned shareholders whose equity share(s) are liable to be transferred to the IEPF Authority, as aforesaid, on the website of the Bank i.e. www.axisbank.com under Shareholders Corner -> Investors FAQs -> 'List of shareholders w.r.t. transfer of unclaimed shares and dividend to IEPF'.

Concerned shareholders holding equity shares of the Bank, in physical form which are liable to be transferred to the IEPF Authority, may note that the Bank would be issuing duplicate share certificate(s) in lieu of the original share certificate(s) held by them for the purpose of transfer of such equity shares to the IEPF Authority and upon such issue, the Bank shall inform the depositories by way of corporate action to convert such duplicate share certificate(s) into DEMAT form and transfer in favour of the IEPF Authority. The original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding equity shares of the Bank in dematerialized form may note that the Bank shall inform the depositories by way of corporate action for transfer of shares in favour of the DEMAT account of the IEPF Authority.

In case the concerned shareholders do not claim their unclaimed dividend(s) by 4th August 2020, the Bank shall with a view to comply with the Rules, transfer the equity shares to the IEPF Authority, as aforesaid, without any further notice to such shareholders.

Please note that no claim shall lie against the Bank in respect of unclaimed dividend(s) amount and equity shares of the Bank transferred to the IEPF Authority. The concerned shareholders may claim such dividend(s) and corresponding equity shares transferred to the IEPF Authority, including all benefits accruing on such equity shares, if any, from the IEPF Authority, after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, the shareholders are requested to contact Shri G Vasanth Rao Chowdari, Manager-RIS at KFin Technologies Private Limited, Unit: Axis Bank Limited, Karvy Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032. Tel No.: +91 40-6716 2222, Email ID: einward.ris@kfintech.com, vasanth.g@kfintech.com

For Axis Bank Limited
Sd/-
Girish V. Koliyote
Company Secretary
ACS 14285

Place: Mumbai
Date: 21st May 2020



22/5

IE

